



કીડીબાઈનું ખેતર

— દુર્ગોશ શુક્લ

કીડીબાઈનું ખેતર નાનું. ચોમાસે વાવે ને બારે માસ બેઠાં—બેઠાં ખાય. જાતે ખેતી થાય નહીં. ચોમાસું આવે એટલે મંકોડાને કહે :

“મંકોડાભાઈ, ખેતર ખેડો,

તો પહેરાવું સોના તોડો.”

મંકોડાભાઈ તો જે મંડે ને તે ખેતર ખેડી નાખે, એટલે કીડીબાઈ ચકલાને કહે :

“ચકલાભાઈ, વેરો ચણ,

બાજરી દેશું પૂરી મણા.”

ચકલો ચાંચમાં દાણા લાવે ને ખેતર આખું વાવી આપે. ત્યાં તો આકાશમાં વરસાદનું વાદળું દેખાય. કીડી કહે :

“વાદળ, તું જો વરસે પાણી,

બારે મહિના ઘેર ઉજાણી.”

વાદળ કીડીબાઈના ખેતરમાં વરસે.

બાજરો ઊગે ને મોટાં ભરેલાં દૂડાં તોલે. ત્યાં આવે પારેવડાં કણ ચણવા. કીડીબાઈ કહે :

“આધાં રહેજો ઓ પારેવાં,

અનાજ પૂરું દો ઉતરવા.”

પંખીડાં આધાં રહે. કોઈ અનાજ ચણે નહીં.

કીડીબાઈના ખેતરમાં મજાનો બાજરો થાય. દૂડાં વઢાય ને ખળો ઠલવાય. અનાજ છૂટું પડાય ને ગાડાં ભરી ઘરભેગું કરાય. કીડીબાઈનો કોઠાર અનાજે છલકાઈ જાય.

કીડીબાઈ દિલના ઉદાર. ઉપકારનો બદલો વળો, તો જ એમના જીવને જંપ મળો.

કીડીબાઈ મંકોડાને બોલાવે ને કહે :

“તારી મજૂરી કાળી,

બાજરાની ભર થાળી.”

થાળી ભરીને મંકોડો બાજરી લઈ જાય.

પણી આવે ચકલાભાઈ. કીડી કહે :

“તારી મહેનત ઘણી,

ચોથા ભાગનો ઘણી.”

ચકલાને ચોથા ભાગનો બાજરો આપી રાજુ કરે.

આકાશમાં ઘેરાય વાદળું કે કીડીબાઈ બોલે :

“બધી તમારી દયા,

સુખમાં દિવસ ગયા.”

પારેવડાંને તો બારે માસ આંગણે નોતરે. ચણ નાખે ને મીઠે અવાજે ગાય :

“પેટ તમારું ઠરશે,

તો સૌની મહેનત ફળશે.

ચણો પારેવાં, ચણો.”